

B.Ed. Semester - 4 (CBCS) Examination
March/April - 2024 (NEW COURSE)
G-1 Accounting (Ssc - 5)

Time: 1:15 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ નીચેના પ્રત્યેક પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.

(૦૫)

1. ભાગીદારી કરારનામું એ પેઢીનું શું ગણાય?
2. પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે?
3. શેરમૂડી એટલે શું?
4. નાણાકીય પત્રકો એટલે શું?
5. કાચો નફો એટલે શું?

પ્રશ્ન-૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખો.

(૧૦)

1. ભાગીદારીના કોઈપણ ચાર લક્ષણો સમજાવો.
2. પાઘડીના મૂલ્યાંકનની સાદી સરેરાશ નફાની રીતનું ઉદાહરણ આપો.
3. પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો તફાવત આપો.
4. નાણાકીય પત્રકોનું મહત્વ સમજાવો.
5. ગુણોત્તર વિશ્લેષણની બે મર્યાદાઓ જણાવો.
6. રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું?

પ્રશ્ન-૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના વિસ્તૃત જવાબ લખો.

(૨૦)

1. નફા-નુકસાન ફાળવણી ખાતું એટલે શું? તેમાં દર્શાવવાથી વિગતો દર્શાવો.
2. પાઘડીનો અર્થ આપી તેના મૂલ્યાંકનને અસર કરતા પરિબલો સમજાવો.
3. શેર મૂડીનું વર્ગીકરણ જણાવો.
4. નાણાકીય પત્રકો તૈયાર કરવાના હેતુઓની વિગતે ચર્ચા કરો.
5. ચોખ્ખા નફાનો ગુણોત્તર સમજાવો.
6. રોકડ પ્રવાહ પત્રકનો નમુનો આપો.

ENGLISH VERSION

Que-1 Answer each of the following question in short. (05)

1. What is a partnership deed for a firm?
2. Which type of asset is 'Goodwill'?
3. What is share capital?
4. What is financial statements?
5. What is gross profit?

Que-2 Write answer to any five of the following question. (10)

1. Explain any four characteristics of partnership.
2. Give example of simple average method for the valuation of goodwill.
3. Give difference between preference share and equity share.
4. Explain importance of financial statements.
5. Describe two limitations of ratio analysis.
6. What is investing activities?

Que-3 Write the answer to five of the following question in detail. (20)

1. What is profit-loss appropriation account? Which items are disclosed in it?
2. Give the meaning of goodwill and explain the factors affecting to its valuation.
3. State classification share capital in detail.
4. Discuss objectives of preparing financial statements in detail.
5. Explain net profit ratio.
6. Give specimen of cash flow statement.
